



Renewables

June 20, 2021

BSE Limited

Floor 25, P J Towers,
Dalal Street,
Mumbai – 400 001
Scrip Code: 541450

National Stock Exchange of India Limited

Exchange Plaza,
Bandra Kurla Complex,
Bandra (E), Mumbai – 400 051
Scrip Code: ADANIGREEN

Sub: Newspaper Advertisement – 6th Annual General Meeting through Video Conferencing / Other Audio Visual Means (“VC / OAVM”) facility

Dear Sir(s),

Please find enclosed herewith copies of newspaper advertisements published in Indian Express (English) and Jaihind (Gujarati) on June 20, 2021, both newspapers having electronic editions, in terms of Ministry of Corporate Affairs Circular No. 20/2020 dated May 05, 2020 and Circular no. 02/2021 dated January 13, 2021, inter-alia, intimating that the 6th Annual General Meeting of the Company will be held on Tuesday, July 13, 2021 at 10.00 a.m. through VC / OAVM facility.

Kindly take the same on your record.

Yours faithfully,

For, Adani Green Energy Limited

Pragnesh Darji

Company Secretary

Encl: as above.


Adani Green Energy Limited
Adani Corporate House, Shantigram,
Nr Vaishno Devi Circle, S G Highway
Khodiyar, Ahmedabad 382 421
Gujarat, India
CIN: L40106GJ2015PLC082007

Tel +91 79 2555 5555
Fax +91 79 2555 5500
investor.agel@adani.com
www.adanigreenenergy.com

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

indianexpress.com



I arrive at a conclusion not an assumption.

Inform your opinion with detailed analysis.

The Indian EXPRESS
— JOURNALISM OF COURAGE —

adani

Renewables

Adani Green Energy Limited

NOTICE TO THE SHAREHOLDERS OF 6TH ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the 6th Annual General Meeting ("AGM") of the Company will be held on Tuesday, 13th July, 2021 at 10:00 a.m. through Video Conference ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of AGM, which is being circulated to the Members in due course of time.

In view of the continuing COVID-19 pandemic, the Government of India, Ministry of Corporate Affairs, vide its Circular No. 14/2020 dated 8th April, 2020, Circular No. 17/2020 dated 13th April, 2020, Circular No. 20/2020 dated 5th May, 2020 and Circular No. 02/2021 dated 13th January, 2021 and also Securities Exchange Board of India, vide its circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021, ("Circulars"), have permitted the holding of AGM through VC/OAVM, without the physical presence of the Members at a common venue. In compliance with these Circulars and the relevant provisions of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the AGM of the Members of the Company will be held through VC/OAVM. In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Integrated Annual Report 2020-21 is being sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company / Depositories. Members may note that the Notice of AGM and Integrated Annual Report 2020-21 will also be available on the Company's website - www.adanigreenenergy.com, website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and the AGM Notice is also available on the website of NSDL (agency for providing the Remote e-Voting facility) i.e. www.evoting.nsdl.com. Members can attend and participate in the AGM through the VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies Act, 2013.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). The manner of voting by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email address has been provided in the Notice of AGM.

In case Member(s) have not registered their e-mail addresses with the Company / Depository, please follow the below instructions to register e-mail address for obtaining Annual Report and login details for e-voting -

- For members holding shares in Physical mode - please provide necessary details like Folio No., Name of shareholder by email to investor.agel@adani.com.
- Members holding shares in Demat mode can get their E-mail ID registered by contacting their respective Depository Participant or by email to investor.agel@adani.com.

The 6th AGM Notice will be sent to the shareholders holding shares as on cut-off for the dispatch in accordance with the applicable laws on their registered e-mail addresses in due course.

In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available at www.evoting.nsdl.com., under help section or contact at toll free number 1800-1020-990 or send a request at evoting@nsdl.co.in.

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Ms. Sarita Mote, National Securities Depository Limited, Trade World, A Wing, 4th Floor, Kamla Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400013; Email: evoting@nsdl.co.in or aforesaid toll free number.

For, Adani Green Energy Limited

Pragnesh Darji
Company Secretary

Place: Ahmedabad
Date: 19th June, 2021

Registered Office: "Adani Corporate House", Shantigram, Nr. Vaishno Devi Circle, S. G. Highway, Khodiyar, Ahmedabad - 382421, Gujarat, India
Phone No.: +91-79-2656 5555 | Fax No.: +91-79-2555 5500
Website: www.adanigreenenergy.com | CIN: U40106GJ2015PLC082007

The Indian EXPRESS
— JOURNALISM OF COURAGE —



Hamesha Se Hamesha Ke Liye

presents

The Indian EXPRESS
e.AQQA

WHERE
NEWSMAKERS
DROP IN FOR
A CANDID CHAT.



Express e.Adda hosts

Yogi Adityanath
Chief Minister, Uttar Pradesh

in conversation with

Anant Goenka
Executive Director
Indian Express Group

Ravish Tiwari
Political Editor &
Chief of National Bureau
The Indian Express

By invitation only.

Associate Partners



ADVERTORIAL | An initiative by **RED**
Read. Engage. Deliver.

VOCAL FOR LOCAL



Vocal For Local Gains Momentum with the Rollout of Several Initiatives!

WITH PM Modi's call to go "Vocal for Local" gaining significant traction in the past few months, since it was first declared in May last year, many sectors and industries have embarked on a mission to manufacture their products locally. While launching the initiative back then, PM Modi had said that 'local' has helped us through the corona crisis and has helped us survive. The PM had called upon the industries to spur local manufacturing and efficiency in order to compete with the foreign manufacturers whilst helping the world.

Indeed, local manufacturers have helped us in many ways and that, too, in various sectors. For example, the growth of India's personal protective equipment (PPE) sector from zero before March 2020, to 4,50,000 pieces a day by the beginning of July 2020, is considered as a fine example of Vocal for Local, initiating our country's journey towards becoming a self-reliant economy. The PPE industry in India had become worth Rs 10,000 crore (US\$1.4 billion) in three months, the second largest after China.

In July 2020, India's own 'Made in India' 5G network was announced by Reliance Jio. As per latest reports, "Reliance Jio has asserted that its Jio 5G network will be powered by indigenous developed network, hardware and technology components." To put a curb on its high defence import bill and spur indigenisation of defence production, Ministry of Defence announced the import embargo on 101 defence equipment in August 2020, leading to a massive push for Atmanirbhar Bharat.

Giving further boost to this initiative, Fertilisers Minister D V Sadananda Gowda announced in



September 2020 that India will be self-reliant in fertiliser production by 2023, as new fertiliser manufacturing units are being set up with an investment of Rs 40,000 crore to reduce dependency on imports.

In one of his 'Mann Ki Baat' programmes last year, PM Modi urged start-ups to develop indigenous apps to replace the ones that are in vogue today and are controlled by foreign companies, reiterating his commitment for Atmanirbhar Bharat. He also urged start-ups and entrepreneurs to develop innovative toys and games to meet local demand and to explore opportunities in the global Toy industry market, estimated at around Rs. 7 lakh crore.

The Commerce and Industry Ministry came out with a quality control order for the sector to stop flow of cheap sub-standard toys into the domestic market. The ministry had also increased import duty last year on toys. The other areas which could be considered for the sector include promotion of research and development and de-

sign centres for toys. Launching its new Tourism policy 2021, Gujarat would follow an integrated approach to increase the visibility of products made in India that are unique and less explored and demonstrate the art and culture of Gujarat, thus giving a boost to the "Vocal for Local" vision.

Recently, Health Minister Harsh Vardhan said that since healthcare products are one of the most commonly targeted industry for counterfeiters, going Vocal For Local will be an extremely potent tool in India's fight against illicit trade in this sector. On the COVID-19 vaccine front, Serum Institute of India's Covishield and Bharat Biotech's Covaxin, developed with the Indian Council of Medical Research (ICMR) vindicate PM Narendra Modi's clarion call of "Vocal for Local" and are reflective of the country's immense innovative and scientific temper.

Even during the festive season, people's response to "Vocal for Local" initiative was very enthusiastic. Thanks to the momentum created by the government in this direction, people are now aware of the need to support local manufacturing. During the festive season, people moved away from buying Chinese products. This consequently led to our local business community manufacturing festival-related products, such as fancy lights, home decoration goods, kitchenware and appliances, idols of Indian

Gods, toys, wall hangings, lamps, home furnishing items, footwear, garments and apparels, gifting sets, electrical gadgets and other items, to provide stimulus to our indigenous market, generating good domestic sales volume.

Similarly, many domestic cookware/ kitchenware brands are witnessing good sales volume as the "Vocal for Local" campaign has captured the minds of consumers amidst the rising sentiment of buying and promoting local products. Home-grown kitchen appliances companies are witnessing good growth due to this campaign. The demand for kitchen appliances and cookware products is also on the rise as many people prefer to cook their own food now rather than ordering from outside amidst the surge of the pandemic. The stay-at-home directive has allowed people to learn cooking skills and that, too, has contributed towards growth of kitchenware and cookware industry.

When it comes to attaining Atmanirbharta in

Beauty and Wellness industry, India has a long list of home-grown brands mushrooming in the country with amazing product line-up that are easy on the pocket compared with foreign brands. According to a report by Goldstein Market Intelligence published in May 2020, "India cosmetics market is valued at nearly USD 11.16 billion in 2017 and is anticipated to grow at a CAGR of 5.91% during the forecast period 2017-2030". Indians are also switching to local brands as they believe that "the ingredients used are less harsh and

include ingredients which Indian women have been using for ages."

With the PM Modi's clarion call for Atmanirbhar Bharat getting stronger, the Indian business community should take up the mantle to manufacture those products that are not being currently manufactured in the country, so that as a nation we're self-reliant.

STOCK MARKET

Intraday 1 Paise
Delivery 10 Paise
Callput @ ₹ 7

Free Demat A/c Lifetime
No Deposit

Sureja : M. 98257 15468
FF 13 -Triveni Sangam Apart. Laxminagar Main Road, Rajkot

ADMISSION OPEN
Nursery to Class 12

Our Parents are Our Brand Ambassadors
You may contact them for the Reviews

20 Years of Excellence with 16000+ Students Every Year

Producing Champions in OLYMPIADS / JEE / NEET / NTSE
Stay backs + Extra Coaching Provided No Tuition Required
100% Board Results

Our Strengths

- Located in Heart of the City.
- E-learning Classrooms with Technology Augmented Teaching.
- Sprawling Campus with Activity Based Learning System.
- Focus on Life Skills and Value Education.

CBSE K. G. Dholakiya School
150 ft. Ring Road, Nana Mava Chowk, Near Balaaji Hall, Rajkot. Ph. : 0281 - 6 111 000

Pratikar Detox Green Tea

Enhancing your Agility, Fitness and Vitality
Delight of Freshness in Every Sip
Enjoy the Goodness of Pratikar Detox Green Tea

FILLED WITH THE GOODNESS OF NATURAL HERBS LIKE GREEN TEA, ASHWAGANDHA, MORINGA, GILOY, TULSI AND TURMERIC

SHETH BROTHERS

વર્ષોથી ચાલતી દુશ્મનીને ભૂલીને મદદની તૈયારી પેલેસ્ટાઈનને કોવિડ વેક્સિન આપવા ઈઝરાયલની તૈયારી

નવી દિલ્હી, તા. ૧૯ કોરોના મહામારીએ વિશ્વના તમામ દેશોને શીખવ્યું છે કે, એકબીજાની મદદ કરીને મોટામાં મોટી આફતનો સામનો કરી શકાય છે. આ મંત્ર પર આગળ વધીને ઈઝરાયલે પેલેસ્ટાઈનને લાખો કોવિડ વેક્સિન પૂરી પાડવાની તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે જમીન કબજાની લડાઈ ખૂબ જ જૂની છે. ગત મહિને પણ બંને દેશ વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો પરંતુ આ સમયે ઈઝરાયલે પેલેસ્ટાઈનને સાથ આપવાનું વચન આપ્યું છે. ઈઝરાયલે પોતાની કુલ વસ્તીના ૮૦ ટકાથી વધારે વયસ્કોને કોરોનાની રસી આપી દીધી છે. ખાસ વાત એ છે કે, ઈઝરાયલમાં નવી સરકારની રચના બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

ઈઝરાયલમાં નવી સરકાર રચાયા બાદ જાહેરાત કરાઈ, ગત મહિને પણ બંને દેશ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો

વખત એક યહૂદી દેશનો જન્મ થયો હતો. પરંતુ જેઝુસલેમને લઈ લડાઈ હજુ પણ ચાલુ હતી કારણ કે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન બંને જેઝુસલેમને પોતાની રાજધાની બનાવવા ઈચ્છતા હતા. ધાર્મિક રીતે પણ જેઝુસલેમ ફક્ત મુસ્લિમ અને યહૂદીઓ જ નહીં પણ ઈસાઈઓ માટે પણ ખૂબ જ ખાસ હતું. આ સંજોગોમાં સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે પહોંચી હતું અને તેણે એક રીતે પેલેસ્ટાઈનનો વધુ એક ટુકડો

અલગ કરી દીધો હતો. આ કારણે જેઝુસલેમનો ટુકડો લિસ્સો સંયુક્ત રાષ્ટ્રના કંટ્રોલમાં આવી ગયો હતો જ્યારે ૪૮ ટકા જમીનનો ટુકડો પેલેસ્ટાઈન અને ૪૪ ટકાનો ટુકડો ઈઝરાયલના હિસ્સામાં રહ્યો હતો. જોકે જમીનની લડાઈ ત્યાર બાદ પણ ચાલુ રહી હતી.



સનદી સેવામાંથી રાજીનામું આપી ઉત્તર પ્રદેશના રાજકારણમાં આવેલા ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અધિકારી એ.કે. શર્મા (વચ્ચે)ને ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી વિશાળ રાજ્યમાં વિધાનસભાની યોજનારી પૂર્વ મોટી જવાબદારી સોંપી છે, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ નિમાયેલા એ.કે. શર્માનું લખનૌમાં પ્રદેશ ઓફિસ ખાતે કાર્યકરો અભિવાદન કરી રહ્યા છે.

ઈરાનમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રાયસીની જીત

દુબઈ, તા. ૧૯ ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઈરાનના સર્વાચ્છેદ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના કઠ્ઠર સમર્થક અને કઠ્ઠરપંથી ન્યાયપાલિકા પ્રમુખ ઈબ્રાહિમ રાયસીએ શનિવારે મોટા અંતરથી જીત મેળવી છે. એવી પ્રતીત

રાયસીએ ૧ કરોડ ૭૮ લાખ મત પ્રાપ્ત કર્યા, ચૂંટણી દોડમાં ઉદારવાદી ઉમેદવાર હેમ્માતી ખુબ પાછળ રહી ગયા

મહત્વનું છે કે ખામેનેઈએ રાયસીના સૌથી મજબૂત વિરોધીને અયોગ્ય ગણાવી દીધા હતા, ત્યારબાદ ન્યાયપાલિકા પ્રમુખે આ મોટી જીત મેળવી છે. રાયસીની ઉમેદવારીને કારણે ઈરાનમાં મતદાતા મતદાન પ્રત્યે ઉદારસીન જોવા મળ્યા અને પૂર્વ કઠ્ઠરપંથી રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીને જાદ સહિત ઘણા લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું હતું. ઈરાનના ગૃહ મંત્રાલયમાં ચૂંટણી મુખ્યાલયના પ્રમુખ જમાલ અર્ફે જણાવ્યું કે, પ્રારંભિક પરિણામોમાં પૂર્વ રેવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર મોહનિસ રેઝાઈને ૩૩ લાખ મત પ્રાપ્ત કર્યા અને હેમ્માતીને ૨૪ લાખ મત મળ્યા છે. એક અન્ય ઉમેદવાર આમિરહુસેન ગાજ્જાદા હાશમીને ૧૦ લાખ મત મળ્યા. ઉદારવાદી ઉમેદવાર તથા સેન્ટ્રલ બેન્કના પૂર્વ પ્રમુખ હેમ્માતી અને પૂર્વ રેવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર મોહનિસ રેઝાઈએ રાયસીને શુભેચ્છા આપી છે. હેમ્માતીએ શનિવારે ઈન્સ્ટિટ્યુશનના માધ્યમથી રાયસીને શુભેચ્છા આપી અને લખ્યુ- મને આશા છે કે તમારૂં પ્રશાસન ઈરાનને ઈસ્લામી ગણરાજ્યને ગર્વ કરવાનું કારણ પ્રદાન કરશે, મહાન રાષ્ટ્ર ઈરાનના કલ્યાણની સાથે

adani અદાણી પાવર લિમિટેડ

૨૫મી વાર્ષિક સાધારણ સભાની સભ્યોને નોટિસ આથી નોટિસ આપવામાં આવે છે કે, અદાણી પાવર લિમિટેડના સભ્યોની ૨૫મી વાર્ષિક સાધારણ સભા (એજુએમ) મંગળવાર, ૧૩મી જુલાઈ, ૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે વિડિઓ કોન્ફરન્સ (વીસી) / અન્ય ઓડીઓ વિડિઓ માધ્યમ (ઓએવીએમ) દ્વારા યોજાશે, જેમાં એજુએમ નોટિસમાં દર્શાવવામાં આવ્યા મુજબના િગ્રાનેસ હાથ ધરાશે.

કોવીડ-૧૯ મહામારીના અંતર્ગત, ભારત સરકારે, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના, પટિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. ૮મી એપ્રિલ, ૨૦૨૦, પટિપત્ર નં ૧૩/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦, પટિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૦ અને પટિપત્ર નં ૦૨/૨૦૨૧ તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ તથા સિક્વોટિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના પટિપત્ર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦ અને SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ ("પટિપત્રો"), દ્વારા એજુએમ કોર્સ પદ વ્યક્તિની પ્રવલ્કા હાજરી વિના માત્ર વીસી / ઓએવીએમ દ્વારા યોજવાની પરવાનગી આપેલ છે. આ પટિપત્રોના અંતર્ગત અને કંપની ધારા, ૨૦૧૩ અંતર્ગત ઘડાયેલા નિયમો અન્વયે તથા સિક્વોટિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટિંગ ઓવિગેશનલ એન્ડ ડિસ્ક્લોઝર્સ રિસ્કવાચરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ ના પાલનમાં, કંપનીના સભ્યોની એજુએમ વીસી / ઓએવીએમ દ્વારા યોજાશે.

ઉપરોક્ત પટિપત્રોના અનુસંધાનમાં, એજુએમની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ જે સભ્યોના ઈ-મેઈલ આઈડી કંપની / ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલ છે, તેમને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવી રહ્યા છે. સભ્યોએ નોંધ લેવી કે એજુએમની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ કંપનીની વેબસાઈટ - www.adanipower.com, સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com તથા www.nseindia.com તથા ઈ-વોટિંગની સુવિધા પુરી પાડનાર સંસ્થા સીડીએસએલની વેબસાઈટ - www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે. સભ્યો એજુએમમાં ફક્ત વીસી / ઓએવીએમ દ્વારા હાજર રહી શકે છે અને ભાગ લઈ શકે છે. એજુએમમાં જોડાવાની વિગતો / સુચનો એજુએમની નોટિસમાં આપવામાં આવેલ છે. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૦૩ અન્વયે, વીસી / ઓએવીએમ દ્વારા જોડાયેલ સભ્યોને, હાજર રહેલ સભ્યોની ગણતરી કરવા માટે માન્ય ગણાશે.

કંપનીએ તમામ સભ્યોને એજુએમની નોટિસમાં વર્ણવવામાં આવેલ તમામ ઠરાવો પર ઇલેક્ટ્રોનિકલી મત આપવા માટે ની સુવિધા આપવામાં આવેલ છે, ઇલેક્ટ્રોનિકલી મત આપવા માટેની વિગતવાર પ્રક્રિયા ડિમેટીસ્લાઈટ્સ મોડ, ફિઝિકલ માધ્યમથી શેર ધરાવતા સભ્યો અને જે સભ્યોએ પોતાનો ઇમેઇલ સરનામું નોંધાવ્યું નથી તેમને એજુએમની સૂચનામાં પ્રદાન કરવામાં આવ્યું છે.

જે સભ્યોએ પોતાના ઈ-મેઈલ આઈડી કંપની / ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે નોંધાવેલ નથી, તેઓએ વાર્ષિક અહેવાલ મેળવવા માટે તથા ઇલેક્ટ્રોનિક વોટિંગ માટેની લોગ-ઈન વિગતો માટે નીચે દર્શાવેલ સુચનોનું પાલન કરવાનું રહેશે:

- જે સભ્યો ફિઝિકલ માધ્યમથી શેર ધારણ કરી રહ્યા છે: ફોલિયો નંબર, સભ્યનું નામ વગેરે વિગતો કંપનીના ઈ-મેઈલ આઈડી: deepak.pandya@adani.com પર મોકલવી.
- જે સભ્યો ડિમેટ માધ્યમથી શેર ધારણ કરી રહ્યા છે તેઓ પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે અથવા કંપનીના ઈ-મેઈલ આઈડી: deepak.pandya@adani.com પર મેલ કરીને પોતાનું ઈ-મેઈલ નોંધાવી શકે છે.

૨૫મી એજુએમની નોટિસ કટ-ઓફ તારીખના રોજ શેર ધરાવતા જે-તે સભ્યોના નોંધાયેલ ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે.

ઈ-વોટિંગ સંબંધી કોર્સપલ પ્રશ્નો હોય, તો સભ્યો તે માટે www.evotingindia.com ઉપર હેલ્પ ટેકશનમાં (ફીડબેક/ સેલ્ફ હેલ્પ ટેકશન - "FAQS" (અવારનવાર પુછાતા પ્રશ્નો) અને ઈ-વોટિંગ મેન્યુઅલ નો ઉપયોગ કરી શકે છે અથવા helpdesk.evoting@cdslindia.com પર ઈ-મેઈલ કરી શકે છે અથવા ટોલ ફ્રી નંબર: ૦૨૨-૨૩૦૫૨૫૪/૪૩ પર ફોન કરીને જાણકારી મેળવી શકે છે.

ઈ-વોટિંગને લગતી કોર્સ પલ ફરિયાદ હોય તો, શ્રી રાકેશ દલવી, મેનેજર, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ, એ વિન્ગ, ૨૫મો માળ, મેટેરોન ફ્યુચરેક્સ, મફતલાલ મિલ્ક કમ્પાઉન્ડ, એમ એમ બેશી માર્ગ, લોહર પટેલ (પૂર્વ), મુંબઈ - ૪૦૦૦૧૩નો સંપર્ક ઈ-મેઈલ: helpdesk.evoting@cdslindia.com પર અથવા ઉપરોક્ત ટોલ ફ્રી નંબર ઉપર કરી શકાશે.

સ્થળ: અમદાવાદ તારીખ: ૧૯-૦૬-૨૦૨૧
રજીસ્ટર્ડ ઓફિસ: "અદાણી કોર્પોરેટ હાઉસ", શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ. જી. હાઈવે, ખોડિયાર, અમદાવાદ - ૩૮૨૪૨૧, ગુજરાત, ભારત.
ફોન નં.: +૯૧-૭૯-૨૫૫૫ ૭૫૫૫ | ફેક્સ નં.: +૯૧-૭૯-૨૫૫૫ ૭૫૫૫
વેબસાઈટ: www.adanipower.com | સી.આઇ.એન.: L40100GJ1996PLC030533

adani અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ

૨૯મી વાર્ષિક સાધારણ સભાની સભ્યોને નોટિસ આથી નોટિસ આપવામાં આવે છે કે, અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના સભ્યોની ૨૯મી વાર્ષિક સાધારણ સભા (એજુએમ) સોમવાર, ૧૨મી જુલાઈ, ૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે વિડિઓ કોન્ફરન્સ (વીસી) / અન્ય ઓડીઓ વિડિઓ માધ્યમ (ઓએવીએમ) દ્વારા યોજાશે, જેમાં એજુએમ નોટિસમાં દર્શાવવામાં આવ્યા મુજબના િગ્રાનેસ હાથ ધરાશે.

કોવીડ-૧૯ મહામારીના અંતર્ગત, ભારત સરકારે, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના, પટિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. ૮મી એપ્રિલ, ૨૦૨૦, પટિપત્ર નં ૧૩/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦, પટિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૦ અને પટિપત્ર નં ૦૨/૨૦૨૧ તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ તથા સિક્વોટિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના પટિપત્ર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦ અને પટિપત્ર નં SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ ("પટિપત્રો"), દ્વારા એજુએમ કોર્સ પદ વ્યક્તિની પ્રવલ્કા હાજરી વિના માત્ર વીસી / ઓએવીએમ દ્વારા યોજવાની પરવાનગી આપેલ છે. આ પટિપત્રોના અંતર્ગત અને કંપની ધારા, ૨૦૧૩ અંતર્ગત ઘડાયેલા નિયમો અન્વયે તથા સિક્વોટિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટિંગ ઓવિગેશનલ એન્ડ ડિસ્ક્લોઝર્સ રિસ્કવાચરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ ના પાલનમાં, કંપનીના સભ્યોની એજુએમ વીસી / ઓએવીએમ દ્વારા યોજાશે.

ઉપરોક્ત પટિપત્રોના અનુસંધાનમાં, એજુએમની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ જે સભ્યોના ઈ-મેઈલ આઈડી કંપની / ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલ છે, તેમને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવી રહ્યા છે. સભ્યોએ એ પણ નોંધ લેવી કે એજુએમની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ કંપનીની વેબસાઈટ - www.adanienterprises.com, સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com તથા www.nseindia.com તથા ઈ-વોટિંગની સુવિધા પુરી પાડનાર સંસ્થા સીડીએસએલની વેબસાઈટ - www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે. સભ્યો એજુએમમાં ફક્ત વીસી / ઓએવીએમ દ્વારા હાજર રહી શકે છે અને ભાગ લઈ શકે છે. એજુએમમાં જોડાવાની વિગતો / સુચનો એજુએમની નોટિસમાં આપવામાં આવેલ છે. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૦૩ અન્વયે, વીસી / ઓએવીએમ દ્વારા જોડાયેલ સભ્યોને, હાજર રહેલ સભ્યોની ગણતરી કરવા માટે માન્ય ગણાશે.

કંપનીએ તમામ સભ્યોને એજુએમની નોટિસમાં વર્ણવવામાં આવેલ તમામ ઠરાવો પર ઇલેક્ટ્રોનિકલી મત આપવા માટે ની સુવિધા આપવામાં આવેલ છે, ઇલેક્ટ્રોનિકલી મત આપવા માટેની વિગતવાર પ્રક્રિયા ડિમેટીસ્લાઈટ્સ મોડ, ફિઝિકલ માધ્યમથી શેર ધરાવતા સભ્યો અને જે સભ્યોએ પોતાનો ઇમેઇલ સરનામું નોંધાવ્યું નથી તેમને એજુએમની સૂચનામાં પ્રદાન કરવામાં આવેલ છે.

જે સભ્યોએ પોતાના ઈ-મેઈલ આઈડી કંપની / ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે નોંધાવેલ નથી, તેઓએ વાર્ષિક અહેવાલ મેળવવા માટે તથા ઇલેક્ટ્રોનિક વોટિંગ માટેની લોગ-ઈન વિગતો માટે નીચે દર્શાવેલ સુચનોનું પાલન કરવાનું રહેશે:

- જે સભ્યો ફિઝિકલ માધ્યમથી શેર ધારણ કરી રહ્યા છે: ફોલિયો નંબર, સભ્યનું નામ વગેરે વિગતો કંપનીના ઈ-મેઈલ આઈડી: krutarth.thakkar@adani.com પર મોકલવી.
- જે સભ્યો ડિમેટ માધ્યમથી શેર ધારણ કરી રહ્યા છે તેઓ પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે અથવા કંપનીના ઈ-મેઈલ આઈડી: krutarth.thakkar@adani.com પર મેલ કરીને પોતાનું ઈ-મેઈલ નોંધાવી શકે છે.

૨૯મી એજુએમની નોટિસ કટ-ઓફ તારીખના રોજ શેર ધરાવતા જે-તે સભ્યોના નોંધાયેલ ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે. ઈ-વોટિંગ સંબંધી કોર્સપલ પ્રશ્નો હોય, તો સભ્યો તે માટે www.evotingindia.com ઉપર હેલ્પ ટેકશનમાં (ફીડબેક/ સેલ્ફ હેલ્પ ટેકશન - "FAQS" (અવારનવાર પુછાતા પ્રશ્નો) અને ઈ-વોટિંગ મેન્યુઅલ નો ઉપયોગ કરી શકે છે અથવા helpdesk.evoting@cdslindia.com પર ઈ-મેઈલ કરી શકે છે અથવા ટેલિફોન નંબર: ૦૨૨-૨૩૦૫૨૫૪/૪૩ પર ફોન કરીને જાણકારી મેળવી શકે છે.

ઈ-વોટિંગને લગતી કોર્સ પલ ફરિયાદ હોય તો, સરજીતા મોટે, નેશનલ સિક્વોટિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, ટ્રેડ વર્ક્સ, એ વિન્ગ, ચોથો માળ, કમલા મિલ્ક કમ્પાઉન્ડ, સેનાપતિ વાપટ માર્ગ, લોહર પટેલ (પૂર્વ), મુંબઈ - ૪૦૦ ૦૧૩નો સંપર્ક ઈ-મેઈલ: evoting@nsdl.co.in પર અથવા ઉપરોક્ત ટોલ ફ્રી નંબર ઉપર કરી શકાશે.

સ્થળ: અમદાવાદ તારીખ: ૧૯-૦૬-૨૦૨૧
રજીસ્ટર્ડ ઓફિસ: "અદાણી કોર્પોરેટ હાઉસ", શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ. જી. હાઈવે, ખોડિયાર, અમદાવાદ - ૩૮૨૪૨૧, ગુજરાત, ભારત. | ફોન નં.: +૯૧-૭૯-૨૫૫૫ ૭૫૫૫ | ફેક્સ નં.: +૯૧-૭૯-૨૫૫૫ ૭૫૫૫
વેબસાઈટ: www.adanigreenenergy.com | સી.આઇ.એન.: U40106GJ2015PLC082007

adani અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ

૬ઠ્ઠી વાર્ષિક સાધારણ સભાની સભ્યોને નોટિસ આથી નોટિસ આપવામાં આવે છે કે, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના સભ્યોની ૬ઠ્ઠી વાર્ષિક સાધારણ સભા (એજુએમ) મંગળવાર, ૧૩મી જુલાઈ, ૨૦૨૧ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે વિડિઓ કોન્ફરન્સ (વીસી) / અન્ય ઓડીઓ વિડિઓ માધ્યમ (ઓએવીએમ) દ્વારા યોજાશે, જેમાં એજુએમ નોટિસમાં દર્શાવવામાં આવ્યા મુજબના િગ્રાનેસ હાથ ધરાશે.

કોવીડ-૧૯ મહામારીના અંતર્ગત, ભારત સરકારે, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના, પટિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. ૮મી એપ્રિલ, ૨૦૨૦, પટિપત્ર નં ૧૩/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦, પટિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૦ અને પટિપત્ર નં ૦૨/૨૦૨૧ તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ તથા સિક્વોટિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના પટિપત્ર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦ અને SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ ("પટિપત્રો"), દ્વારા એજુએમ કોર્સ પદ વ્યક્તિની પ્રવલ્કા હાજરી વિના માત્ર વીસી / ઓએવીએમ દ્વારા યોજવાની પરવાનગી આપેલ છે. આ પટિપત્રોના અંતર્ગત અને કંપની ધારા, ૨૦૧૩ અંતર્ગત ઘડાયેલા નિયમો અન્વયે તથા સિક્વોટિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટિંગ ઓવિગેશનલ એન્ડ ડિસ્ક્લોઝર્સ રિસ્કવાચરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ ના પાલનમાં, કંપનીના સભ્યોની એજુએમ વીસી / ઓએવીએમ દ્વારા યોજાશે.

ઉપરોક્ત પટિપત્રોના અનુસંધાનમાં, એજુએમની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ જે સભ્યોના ઈ-મેઈલ આઈડી કંપની / ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલ છે, તેમને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવી રહ્યા છે. સભ્યોએ એ પણ નોંધ લેવી કે એજુએમની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ કંપનીની વેબસાઈટ - www.adanigreenenergy.com, સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com તથા www.nseindia.com તથા ઈ-વોટિંગની સુવિધા પુરી પાડનાર સંસ્થા સીડીએસએલની વેબસાઈટ - www.evotingnsdl.com પર પણ ઉપલબ્ધ છે. સભ્યો એજુએમમાં ફક્ત વીસી / ઓએવીએમ દ્વારા હાજર રહી શકે છે અને ભાગ લઈ શકે છે. એજુએમમાં જોડાવાની વિગતો / સુચનો એજુએમની નોટિસમાં આપવામાં આવેલ છે. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૦૩ અન્વયે, વીસી / ઓએવીએમ દ્વારા જોડાયેલ સભ્યોને, હાજર રહેલ સભ્યોની ગણતરી કરવા માટે માન્ય ગણાશે.

કંપનીએ તમામ સભ્યોને એજુએમની નોટિસમાં વર્ણવવામાં આવેલ તમામ ઠરાવો પર ઇલેક્ટ્રોનિકલી મત આપવા માટે ની સુવિધા આપવામાં આવેલ છે, ઇલેક્ટ્રોનિકલી મત આપવા માટેની વિગતવાર પ્રક્રિયા ડિમેટીસ્લાઈટ્સ મોડ, ફિઝિકલ માધ્યમથી શેર ધરાવતા સભ્યો અને જે સભ્યોએ પોતાનો ઇમેઇલ સરનામું નોંધાવ્યું નથી તેમને એજુએમની સૂચનામાં પ્રદાન કરવામાં આવ્યું છે.

જે સભ્યોએ પોતાના ઈ-મેઈલ આઈડી કંપની / ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે નોંધાવેલ નથી, તેઓએ વાર્ષિક અહેવાલ મેળવવા માટે તથા ઇલેક્ટ્રોનિક વોટિંગ માટેની લોગ-ઈન વિગતો માટે નીચે દર્શાવેલ સુચનોનું પાલન કરવાનું રહેશે:

- જે સભ્યો ફિઝિકલ માધ્યમથી શેર ધારણ કરી રહ્યા છે: ફોલિયો નંબર, સભ્યનું નામ વગેરે વિગતો કંપનીના ઈ-મેઈલ આઈડી: investor.agel@adani.com પર મોકલવી.
- જે સભ્યો ડિમેટ માધ્યમથી શેર ધારણ કરી રહ્યા છે તેઓ પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે અથવા કંપનીના ઈ-મેઈલ આઈડી: investor.agel@adani.com પર મેલ કરીને પોતાનું ઈ-મેઈલ નોંધાવી શકે છે.

૬ઠ્ઠી એજુએમની નોટિસ કટ-ઓફ તારીખના રોજ શેર ધરાવતા જે-તે સભ્યોના નોંધાયેલ ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે.

સ્થળ: અમદાવાદ તારીખ: ૧૯-૦૬-૨૦૨૧
રજીસ્ટર્ડ ઓફિસ: "અદાણી કોર્પોરેટ હાઉસ", શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ. જી. હાઈવે, ખોડિયાર, અમદાવાદ - ૩૮૨૪૨૧, ગુજરાત, ભારત. | ફોન નં.: +૯૧-૭૯-૨૫૫૫ ૭૫૫૫ | ફેક્સ નં.: +૯૧-૭૯-૨૫૫૫ ૭૫૫૫
વેબસાઈટ: www.adanigreenenergy.com | સી.આઇ.એન.: U40106GJ2015PLC082007

પાકિસ્તાનમાં લોકશાહીને લજવતી ઘટના બલુચિસ્તાનના મુખ્યમંત્રી પર વિપક્ષી સભ્યોએ બોટલો ફેંકી

સ્વેટા, તા. ૧૯ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના મુખ્યમંત્રી જામ કમાલને વિધાનસભાની બહાર ઘેરી લેવામાં આવ્યા હતા. વિધાનસભાના વિપક્ષના સભ્યો દ્વારા પાણીની બોટલો ફેંકી અને જૂતા-ચપ્પલ વરસાવ્યા હતા. આ દરમિયાન ખૂબ જ હંગામો થયો હતો અને મુખ્યમંત્રીએ વિધાનસભાની અંદર જવા માટે અન્ય માર્ગનો ઉપયોગ કરવો પડ્યો હતો. બલુચિસ્તાન એસેમ્બલીમાં બજેટ સત્ર દરમિયાન વિપક્ષના સભ્યો વિરોધ કરી રહ્યા હતા. તેઓએ આખું સદન ઘેરી લીધું અને બહારથી બંધ દરવાજા બંધ કરી દીધા. ત્યારબાદ તેમણે ઉગ્ર સુઓચ્ચાર કર્યા. આ દરમિયાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી જામ કમાલ પહોંચ્યા ત્યારે વિપક્ષના

સભ્યો ધક્કામુકી પર ઉતરી આવ્યા હતા. તેમની આજુબાજુ એક સફરજ સુરક્ષા કવચ હતું, ત્યારબાદ તેઓએ પાણીની બોટલો ફેંકવાનું શરૂ કર્યું હતું

બલુચિસ્તાન પ્રાંતના મુખ્યમંત્રી જામ કમાલને વિરોધ પક્ષ દ્વારા વિધાનસભાની બહાર ઘેરી લેવામાં આવ્યા હતા

અને હંગામો મચાવ્યો હતો. દરમિયાન સભ્યોએ તેની ઉપર ચપ્પલ પણ ફેંકવા હતા. એટલું જ નહીં તેમણે વાંધાજનક ટિપ્પણી પણ કરી હતી. વિપક્ષી નેતાઓના ઉગ્ર વિરોધ અને અભદ્ર અભિવ્યક્તિને ધ્યાનમાં રાખીને, સુરક્ષા દળોએ આગેવાની લીધી અને તેમના પર લાઠીચાર્જ કર્યો.

માત્ર ૨૮ કલાકમાં ૧૦ માળનું બિલ્ડિંગ ખસડી દીધું: ચીને નવો ઈતિહાસ રચ્ય